

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ દ્વારા “વિશ્વ મધમાખી દિવસ”ની

## ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા વિશ્વ મધમાખી દિવસ ૨૦૨૧ની ઉજવણી તા. ૨૦-૦૫-૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવેલ. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. એચ. એલ. કાયા, વરીષ્ટ વૈજ્ઞાનિક અને વડા (ઈ/યા) દ્વારા કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના શાબ્દીક સ્વાગત દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત વિશ્વ મધમાખી દિવસનું આપણા જીવનમાં મહત્વ અંગે શ્રી. એન. કે. રાહોડ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)એ સમજ આપેલ, ત્યારબાદ કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી. એચ. બી. પારેખ, નાયબ બાગાયત નિયામકશ્રીએ મધમાખી પાલન માટેની સરકારી યોજનાઓ વિશે માહિતી આપેલ. આ કાર્યક્રમમાં ત્યારબાદના ચરણમાં મુખ્ય મહેમાન શ્રી. દિપેનભાઈ પટેલ, ફાઉન્ડર, બી ફાર્મ પ્રોડક્ટ, વડોદરા દ્વારા વ્યવસાયીક મધમાખી પાલન તેમજ મધમાખી પાલાનના જુદા જુદા ઉત્પાદન જેવા કે મધ, મીણ, મધમાખીના ઝેર વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપેલ. તેમજ નાયબ ખેતી નિયામક, શ્રી. સી. એમ. પટેલે મધમાખીની વિભિન્ન પ્રજાતીઓ તેમજ દાહોદ જિલ્લામાં મધમાખી પાલનની શક્યતાઓ અને મુશ્કેલીઓ વિશે ખેડૂતભાઈઓને માહિતગાર કર્યા, છેલ્લા ચરણમાં, ડૉ. ટી. એમ. ભરપોડા, નિવૃત્ત પ્રાધ્યાપક, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આફ્યુ, આંણદ દ્વારા મધમાખીઓના પરજીવી, પરભક્ષીઓ તેમજ મધમાખી પાલનમાં આવતા રોગો વિશે સૌને ઊંડાણ પૂર્વકની સમજ આપેલ. કાર્યક્રમનાં અંતે શ્રી. એન. ડી. મકવાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ મહાનુભાવો, વિષય નિષ્ણાંતો તેમજ તમામ કાર્યક્રમના સહભાગીઓની આભારવિધી કરેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી. જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં કુલ ૭૧ ખેડૂતભાઈઓ, ગ્રામ સેવકો, વિસ્તરણ કાર્યકર્તાઓ, આત્મા પ્રોજેક્ટના એટીએમ, બીટીએમશ્રીઓએ ગુગલ મીટના માધ્યમથી ભાગ લીધો હતો.

તા. ૨૦.૦૫.૨૦૨૧

meet.google.com/cmb-cbze-ozb:authuser-0

Harinandan Sodavadiya is presenting

BHAVIK MALI and 36 more

47

Honey bee day - Microsoft PowerPoint

વિશ્વ મધમાખી દિવસ ૨૦૨૧  
અંતર્ગત વેબિનાર

તા: ૨૦-૦૫-૨૦૨૧  
સમય : ૧૬:૦૦ - ૧૮:૦૦ કલાક

આયોજક  
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  
આણંદ કૃષિ યુનીવર્સિટી  
મુવાલિયા ફાર્મ, દાહોદ

AAU  
આણંદ અનુકૂળ સંસ્થા

મધુગૃહ  
ICAR

You

prites

DDH Dahod

ajay

meet.google.com/cmb-cbze-ozb

તા. ૨૦.૦૫.૨૦૨૧

